

‘શક્તાણુ લક્ષ્મા’ મહાવીળે

હેમચંદ્રાચાર્ય ભાગવીનાં લક્ષ્માણ આપતાં, શહેરાતમાં જ જાણાન્યું છે કે આચીન કૈન આગમસૂત્રોની ભાષા અધ્યમાગધી હોવાનું જે કહેવાનું છે તે ખણું ખરું તો (‘પ્રાયः’) પહેલી વિલક્ષિત એકવચનમાં અકારાન્ત નામના અંત્ય અ-કારનો એ-કાર થાય છે એ લક્ષ્માણને ‘ખાનમાં રાખીને કહેવાનું છે, નહીં કે તે પણી દ્શવેલાં સકારનો શકાર, રકારનો લકાર વગેરે લક્ષ્માણને પણ ગણ્યતરીમાં લઈ ને (‘સિદ્ધહેમ’, ૮-૪-૨૮૭ ઉપરની વૃત્તિ). આમાં ‘ધાણુઃખરુ’ (‘પ્રાયः’) એ રાણુ મહત્વનો છે.

શીરસેતીનાં લક્ષ્માણ આપતાં, ૨૬૫માં સૂત્રમાં, ‘નામના અંત્ય નુંનો, પ્રથમા એકવચનનો પ્રત્યય લાગતા પહેલાં, મુ (અનુસ્વાર) થાય છે.’—એ નિયમના ઉદાહરણું તરીકે સમગ્રે ભગવં મહાવીરે એ શાખ્યજ્ઞ આપેલું છે. વળસેનવિજયજીએ તે ‘કલ્યાણ’ના પહેલા સૂત્રમાંથી ઉંડૂત હોવાનો નિર્દેશ કર્યો છે. (‘પ્રાકૃત વ્યાકરણું’,

\* મૂળ લેખ અનેછમાં ગુજરાત મુનિવસિંહીના સંશોધન સામયિક ‘વિદ્યા’માં (ઓગસ્ટ ૧૯૭૮, પૃ. ૧૬૭-૧૭૦) પ્રકારિત.

ઉદ્ઘારણસૂચિ, ૨. ૨૬), પરતુ એ જ શરૂઆતે આગમથીમાં અન્યત્ર અને સ્થળે પણ ભલો છે. અદીં એ હકીકત નોંધાએ કે સૂત્ર ૨૮૫ નીચે આપેલ ઉદ્ઘારણ ભયવં તિથે પદ્ધતે એ પણ ‘કલ્પસ્ત્ર’માં મળતું હોવાના વર્ગસેન-વિજયળાંએ નિર્દેશ કર્યો છે.

ઉક્ત અને ઉદ્ઘારણે, ‘શૌરસેના’નાં ઉદ્ઘારણ તરીકે આપેલા છે, તેથી એવો પ્રશ્ન થાય કે આગમસેનાની આખા તો અધ્યભાગથી છે, તો તેમાંથી શૌરસેનાનાં ઉદ્ઘારણ કેમ આપ્યા છે? પણ સૂત્ર ૩૦૨ વડે સ્પષ્ટીકરણ કરેલું છે: વિશેષ પરિવર્તનો આદ કરતાં ભાગધીમાં શૌરસેની અનુસાર (તથા સૂત્ર ૨૮૫ અનુસાર, પ્રાકૃત પ્રમાણે પણ) ઇન્દ્રાર થાય છે—સૂત્ર ૨૮૭ ઉપરની ગૃહિમાંથી પણ આ ‘આપતનું’ સ્પષ્ટીકરણ મળું રહે છે.

હવે આ સંઅધમાં સૂત્ર ૩૦૨ નીચે આપેલું એક ઉદ્ઘારણ ખાસ નોંધ-પાત્ર છે. આપણે ઉપર સૂત્ર ૨૮૫નું જે ઉદ્ઘારણ નોંધ્યું છે, તે જ ઉદ્ઘારણ અદીં શરૂઆતે મયવં મહાવીલે એવા હેઠે આપેલું છે. આ ઉદ્ઘારણ પણ કોઈ આગમથીમાંથી જ લેવાયાતું આપણે ભાતી શકીએ. અને તો જે સમયું ઉપરિથિત થાય છે તે એ છે કે હેમયંદ્રાચાર્યની સમક્ષ આગમથીએની જે હસ્તપત્રો હતી તેની આપાતું સ્વરૂપ કેવું હતું? હેમયંદ્રાચાર્ય અનુસાર (સૂત્ર ૨૮૭ ઉપરની ગૃહિ) અયમેની અધ્યભાગધીમાં ‘નામાનત અદારના એકાર થાય’ એવા લક્ષણું સિવાય, અગ્રચિત ભાગધીનાં અન્ય લક્ષણો, શીરસનીનાં લક્ષણો. અને પ્રાકૃતનાં લક્ષણો. પણ મળે છે, એ રીતે હેમયંદ્રાચાર્યનું લક્ષણનિરૂપણું તે સુસંગત જ છે. પણ આપણી પાસે આમાંથી એ હકીકત આવે છે કે કેઈક આગમથીયની હેમયંદ્રાચાર્યને ઉપલબ્ધ ઉસ્તમેતમાં સમગ્રે ભગવં મહાવીર, તો કેઈક ઉસ્તમેતમાં શરૂઆતે મહાવીલે એવો ખાડ હતો.

આનાં પરથી એક અટકા એવી ધર્મ શરૂ કે ‘કલ્પસ્ત્ર’ જેવા નાનુ પ્રયત્નિત અને પ્રચારમાં વંચુ રહેતા અથની ભૂગ્રાં ભાવા પર ઉત્તરકાલીન પરિવર્તનોનો (માલારાષ્ટ્ર, પ્રાકૃત, માટે જે લાક્ષણિક છે તેવા ઇન્દ્રારનો) પ્રભાવ પડ્યો હોય; પરતુ ‘આચારાંગ’ જેવા અથેની તલદાલીન હસ્તપત્રમાં ભૂગ્રાં ભાવાનાં લક્ષણો કેટલેં અંગે જળવાઈ રહેલા હોય. શરૂઆતે મયવં મહાવીલે એ ઉદ્ઘારણ ભાગધી તર્ફે નેમાં જળવાયા છે એવો, ‘આચારાંગ’ જેવા સૂત્રની હસ્તપત્રમાંના પાડને ‘આધારે હેમયંદ્રાચાર્ય’ આપ્યું હોય.

## ૨. 'જિલ્હે ભાયણ મરોચો'

પ્રાકૃત સા. જીર્ણનું જુણ થતું હોવા ઉપરાંત જિણ પણ થાય છે એના 'ઉદાહરણ તરીકે સિલે. ૮-૧-૧૦૨ નીચે જિણે મોઅળમચેઓ એ ઉદાહરણ આપ્યું છે. વનસેનવિજયશ્રીએ તે સંદર્ભે, તુલના માટે નીચેને જાણીતો શ્લોક આપ્યો છે ('ઉદાહરણસૂચિ', પૃ. ૬) :

જીર્ણે મોજનમાત્રેય, કવિદઃ પ્રાજિના દયા ।

વૃદ્ધસત્તિવેદવાસ:, વંચાલસ્ત્રીણુ માર્દીત્રમ ॥

પ્રમાણ-દ્રશ્યરિના 'પ્રમાવદ્વારિત'માં (ધ. સ. ૧૨૭૮) (સંપા. જિનવિજય મુનિ, સિ. ક્રી. અ. ૧૩, ૧૬૪૦, પૃ. ૩૬, પદ ૩૨૦) એ જી શ્લોક પાદદિપિમાં ચાર્યાના ચિત્તમાં આપેલો છે. આમાં પ્રથ એ છે કે આ શ્લોક મારી જાણ પ્રમાણે મૂળો સંસ્કૃતમાં જ છે. પરંતુ હેમય-પ્રાચાર્યના 'ઉદાહરણમાં' તેનો એકાંશ-પ્રથમ ચરણ-પ્રાકૃતમાં છે, તે દર્શાવે છે કે તેમને ઉપલખ્ય કોઈક પ્રથમાં તે એકા પ્રાકૃતભાષામાં હોવો જોઈએ, કેમ કે 'ઉદાહરણના' પ્રમાણનો આંગાર ને શાખો વર્ણનું કોઈ પ્રથમાં મળતા હોય એ હસ્તકૃત પર રહેલો છે.

[પૂર્ક નોંધ : ડૉ. હરિવલસ ભાયાણીની, 'ચિલ્ડ્રિન્' જાકરણના સૂત્ર ૮-૧-૧૦૨માં આહેમાચાયેં અપોજીવા ઉદાહરણ 'જિણે મોઅળમચેઓ' અંગે, એ પાંત્રિ ધરારતો નાગ સંસ્કૃત શ્લોક, કોઈક પ્રથમાં પ્રાકૃત ભાષામાં હોવો જોઈજો એવી અદરકા, તદ્દન સાચ્યા છે. એ શ્લોક 'આવરયક-ચૂંઝિં'માં મળી આવ્યો છે.]

'આવરયક-નિર્મંજિન'ની ૮૫૬મી ગાથામાં 'સંક્ષેપ-સામાયિક'નું વર્ણન છે. આ પ્રસંગે ચૂંઝિંદારે એક નાનકડી કથા નિરૂપી છે, તેમાં ચાર સ્તરિયો એકેક લાખ શ્લોક-પ્રમાણ ચાર સંહિતાઓ જિતયનું રાજીને સંભળાવવા જય છે, ત્યારે સંક્ષેપરુચિ રાજીનાં સૂચનાં તેઓ પોતપોતાની સંહિતાને સાર એકેક ચરણમાં વર્ણિય છે. એ ચાર ચરણાં મળીને અનતો શ્લોક તે જીર્ણે મોજનમાત્રેય એ સુપ્રસિદ્ધ શ્લોક જ છે. 'આવરયક-ચૂંઝિં'દારે તેનું' પ્રાકૃત૩૪ કે ૩૫ાંતર ચારીંતે આપ્યું છે :

'જિણે મોઅળમચેઓ, કવિલો પાણિં દયા ।

જિહ્સતીરવિસાસો, વંચાલો તર્થીનુ મહવુ ॥

(મુદ્રિત પ્રતિ, પૃ. ૪૬૮)

આથી શ્રીહેમયન્દ્રાચાર્યાર્થ સામે ‘આવશ્યક—ચૂલ્હિનો આ સંદર્ભ’ હોય અને તેમાંથી તેમણે ૮-૧-૧૦૨ એ સુત્રમાં આ શ્રોણનો એકાંશ ઉદ્ઘાટણ દેખે મુક્યો હોય તે સિદ્ધ થાય છે. સાથે જ, નામૂળ લિખવતે કિંબિત-ની તેમની રચનાનીતિ પરતે આદર પણ વધી જય છે.

શીહાંદચિજય.]

### ૩. સિંહપદ છાંદું ઉદ્ઘાટણ

હેમયન્દ્રાચાર્યાર્થ ‘છાંદોનુશાસન’માં જે છાંદોનું નિર્પણ કર્યું છે તેમાં આપેલાં છાંદોના ઉદ્ઘાટણ તેમણે પોતે રચેલાં છે, એ ઉદ્ઘાટણયોમાં તે તે છાંદું નામ પણ ગૂંઠી લીધેલું છે. અપથ્રંશ વિલાગમાં આપેલું સિંહપદ નામના છાંદું ઉદ્ઘાટણ (એ દોપણી છાંદોના પ્રત્યેક અરખમાં  $4+4+4+4$ ,  $4+4$ ,  $4+4+4+2 = 38$  માત્રા હોય છે) નીચે પ્રમાણે છે :

નાવય-રસ-રંબિય-વર-કામિણિ-પય-પડિઅનિભિહિ બંધિ થઈનિ કિર આસિ સઈ ;  
સંપદ હય-ગય-રૂહિરાતુણ-સીહ-પય-પંકિય તુહ રિષ-ધરણ તિ પેનિથિહિ ॥  
(૭, ૫૧.૧)

‘તારા શત્રુઓના જે પ્રાસાદો સદાયે અળતાથી રંગેલાં સુંદરીઓનાં યરણોનાં પગલાંથી અસર્દીત હોવાનું લોકવિલિ હતું’, તે પ્રાસાદો હવે સિંહનાં, હાથીઓને હણુનાં લેણીથી લાલ થેલાં પગલાંના ડાઢીથી મલિન બનેલાં દેખાય છે.’

આમાં ‘રધુનંશ’ના સોળમા સર્ગમાં આપેલા અયોધ્યાની પડતીના વર્ણનમાં આવતા એક ચિત્રનો જ આપાર લીધી હોવાનું જણાય છે. તે પદ નીચે પ્રમાણે છે :

‘સોપાનમાર્ગેષુ ય યેષુ રામા, નિક્ષિપતવત્યશરણાનું સરાગાનું ।

સંઘોદત-ન્યાંકુલિરસ-હિંઘાં, બાંધૈઃ પદઃ તેષુ નિવીયતે મે ॥

(૧૬, ૧૫)

‘(નીલની આવાસોની) જે સોપાનપદિત પર પહેલાં રમણુઓના અળતાભીનાં યરણોની રંગીન પગલીએ પડતી હતી, તાં હવે હરખુને મારીને આવેલા વાખના રક્તાર્ણ્યા પણ પડી રહ્યા છે’.

બંને વચ્ચેનું સામ્ય ઉધાડું છે. ‘સિંહપદ’ (સિંહપદ) નામ ગૂંઠાય તે રીતનું ઉદ્ઘાટણપદ રચાવા માટે હેમયન્દ્રાચાર્યાર્થને ‘રધુનંશ’ના ઉપર્મુક્ત પદનું અવસરાન લેવા માટે સંસ્મરખું થયું. તેને તેમના ‘રધુનંશ’ના અનુશીલનનું, કાવ્ય-રસના ભાવકલ્પતું અને તીક્ષ્ણ સ્મરતિનું સૂચક ગણીયો.

૪. ભાયાણી